



JAG-001-001321

Seat No. _____

B. A. (Sem. III) (CBCS) Examination

November - 2019

Economics : Paper - 5

(Macro Economics) (Core) (Old Course)

Faculty Code : 001

Subject Code : 001321

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70]

1 રાજ્યીય આવકને માપવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો. 14

અથવા

1 રાજ્યીય આવકનો અર્થ આપી, ભારતમાં રાજ્યીય આવકના વલશો જણાવો. 14

2 કેઈન્સનો અસરકારક માંગનો સિદ્ધાંત સમજાવો. 14

અથવા

2 અસરકારક માંગનો અર્થ સમજાવો. 14

3 સરેરાશ અને સીમાંત વપરાશવૃત્તિ સમજાવો. 14

અથવા

3 વપરાશવૃત્તિને અસર કરતાં પરિબળો જણાવો. 14

4 વ્યાજનો સમય પસંદગીનો સિદ્ધાંત સમજાવો. 14

અથવા

4 કેઈન્સનો વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત સમજાવો. 14

5 નીચેનામાંથી કોઈપણ બેના જવાબ આપો :

- (1) મંદીનો અર્થ અને વ્યાખ્યાઓ
- (2) મંદીજન્ય ખાધ
- (3) મંદીના કારણો
- (4) મંદીને દુર કરવાના ઉપાયો.

ENGLISH VERSION

- 1 Explain the various measurement methods of National Income. 14

OR

- 1 Give the meaning of National Income. Explain the trends of National Income in India. 14

- 2 Explain the aggregate demand theory of Keynes. 14

OR

- 2 Explain the meaning of aggregate demand. 14

- 3 Explain the average and marginal propensity to consume. 14

OR

- 3 Explain the affecting factors of propensity to consume. 14

- 4 Explain the time preference theory of interest. 14

OR

- 4 Explain the liquidity preference theory of interest by Keynes. 14

- 5 Answer any **two** of the following : 14

- (1) Meaning and definition of deflation
 - (2) Deflationary gap
 - (3) Causes of deflation
 - (4) Remedies to eliminate deflation.
-